


(વર્ષ : ૨૦૨૧-૨૨)

અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ

સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ



માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫
કલમ નંબર ૪ (૧) અન્વયે
પ્રો-એક્ટટીવ ડીસ્કલોગર
(લાઇટ વિભાગ)

લાઇટ ખાતું, “સી” -૫લોક, ૫ મો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ -૩૮૦ ૦૦૧
ફોન નંબર : ૦૨૪૨૦૮૨૩

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો :-

લાઈટ વિભાગનાં ટેકનીકલ વિભાગ તથા વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.


લાઈટ વિભાગ દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઓફિસ બીલીંગ, દવાખાના, સ્મશાનગૃહ, સ્વીમીંગ પુલ, અને સ્કુલ બીલીંગના ઇલેક્ટ્રોલિક્ષન, એરકન્ડીશનીંગ, વોટર કુલર, વોટર પંખીંગ સ્ટેશન, સ્વીમીંગ પુલ ફીલ્ટરેશન પ્લાન્ટ, સ્મશાનગૃહોમાં સીએનજી ભડીઓ, લીફ્ટ વગેરેની કેપીટલના SITC તથા તેના ઓપરેશન મેઇન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ ખાતાનાં વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે વર્ગ ૧ થી ૪ સુધીના અધિકારી તથા કર્મચારીઓનાં પગાર, તેઓના સર્વીસ બુક સંબંધીત તેમજ તેઓની નિવૃત્તિ, સૈ.નિવૃત્તિ, અવસાન, રીમુવ, અનફીટ થયા બાદ કર્મચારીઓને મળવાપત્ર લાભો ચુકવવાની કામગીરી જેવા વિવિધ કાર્યો તથા કાર્યલક્ષી સંબંધીત રેકૉર્ડ નીભાવણી અને તેને લગતી આનુષાંગિક કામગીરી તથા ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવનાર કામોનું સક્ષમ સત્તાની મંજુરી મુજબ બજેટ બુકીંગ તેમજ સક્ષમ સત્તાની મંજુરી મુજબ કોન્ટ્રાક્ટરનાં બીલનાં પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે.

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	સંપર્ક નંબર
૧	શ્રી વિશાલકે.નાયક	એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (લાઈટ)	M -૮૭૧૨૮૬૭૪૨૪ O -૦૭૯૨૫૩૮૯૮૯૯
૨	શ્રી એ.એ.મલ	ડે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રોકલ-૨)	M -૮૩૭૬૦૧૭૫૬૫ O -૦૭૯૨૫૩૮૯૮૯૯
૩	શ્રી દિગ્વીજયસિંહ ગઢવી	ડે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રોકલ-૪)	M -૮૩૨૭૦૩૮૭૭૮ O -૦૭૯૨૫૩૮૯૮૯૯
૪	શ્રી નરસિંહભાઈ એન.ગામેતી	ઓફિસ સુપ્રિન્ટેન્નાન્ટ અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટ)	O -૦૭૯૨૫૩૮૯૮૯૯

Organization Chart – Light Department

વર્ષ: ૨૦૨૧-૨૨



(૨) અધિકારીઓ અને કર્મચારીઓનાં કાર્યો તથા ફરજો :

ક્રમ	જગાનું નામ	અધિકારી/કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	એડી. ચોઝ એન્જિનીયર (લાઈટ)	વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોમાં જગાવ્યા મુજબ દરેક વિભાગની વિઝિટ કરવી. ઓ. એન્ડ એમ. ના કોન્ટ્રાક્ટમાં ટેન્ડર મુજબ સ્ટાફ રાખવામાં આવે તથા કામગીરી થાય તે મુજબ ધ્યાન રાખવું. હ્યાત ઈલેક્ટ્રોફલ સિસ્ટમની ઓંમેન્ટેશન કરવાની જરૂરીયાત છે કે કેમ તેની ટેકનીકલ ચકાસણી કરી આગળની યોગ્ય કામગીરી કરવી. કેપીટલ કામ તથા રેવન્યુ કામના ટેન્ડર સમયસર કરવા. એકસ્ટ્રા આઈટમ થતી હોઈ તો તેની ચકાસણી, અન્ય વિકલ્પ, સક્ષમ સત્તાની મંજુરીની કામગીરી. એનજર્ઝને લગતી કામગીરી. પાવર ઇક્ટર ઈમ્પ્રુવમેન્ટ સ્ટાફની વ્યવસ્થા. બજેટને લગતી કામગીરી. પ્રોજેક્ટનું મોનીટરીંગ સમયસર પૂર્ણ થાય તે અંગે કામગીરી, કવોલીટી તથા મેઝરમેન્ટની ચકાસણી. ઇલે. મીકે. સ્પેર્સ, સબમશીબલ પંપની વધારાની સ્પેર વ્યવસ્થા રાખવી. પોતાના હેઠળના સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું. ઇવેલ્યુએશન આરટીઆઈ, એમ પી એમ એલ એ ના પ્રશ્ના સમયસર જવાબ કરવા. વિભાગની વહીવટી કામગીરી.
૨	ડે. સીટી ઈજનેર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઇલે. મીકે. ઇક્વીપમેન્ટ બંધ ના રહે તેનું ધ્યાન રાખવું તથા ઇલે. મીકે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું. કલોરીનેશન ખાન (વડીંગ/સ્પેર) ચાલુ કરીશનમાં રાખવા તથા કલોરીનેશનયુક્ત પાણી જ સપ્લાય થાય તે સુનિશ્ચિત કરવું. મ્યુનિસિપલ સ્નાનાગારમાં પાણીની શુષ્ઠતા અંગે ધ્યાન રાખવું. પ્રીવેન્ટીલ મેઈન્ટેનન્સ સમયસર થાય તેનું ખાનીંગ કરવું. ઓ. એન્ડ એમ. કોન્ટ્રાક્ટ, રીપેરીંગના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહી તેનું ચેકીંગ કરવું. પ્રોજેક્ટના કામના ઓંમેન્ટેશનના કેપીટલ કામોના, રેવન્યુ કામોના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર સ્પેસીઝિકેશન મુજબ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું, પાવર પ્રોક્યોરમેન્ટની સમયબદ્ધ કામગીરી કરવી. કેપીટલ તેમજ રેવન્યુ કામોની એમ.બી. રેકોર્ડિંગ, મેઝરમેન્ટ તથા કવોલીટી ચકાસણીની કામગીરી., પાવર ઇક્ટર ઈમ્પ્રુવમેન્ટની કામગીરી.
૩	આસી.સીટી ઈજનેર	અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઇલે. મીકે. ઇક્વીપમેન્ટ બંધ ના રહે તેનું ધ્યાન રાખવું તથા ઇલે. મીકે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું. કલોરીનેશન ખાન (વડીંગ/સ્પેર) ચાલુ કરીશનમાં રાખવા તથા કલોરીનેશનયુક્ત પાણી જ સપ્લાય થાય તે સુનિશ્ચિત કરવું. મ્યુનિસિપલ સ્નાનાગારમાં પાણીની શુષ્ઠતા અંગે ધ્યાન રાખવું. પ્રીવેન્ટીલ મેઈન્ટેનન્સ સમયસર થાય તેનું ખાનીંગ કરવું. ઓ. એન્ડ એમ. કોન્ટ્રાક્ટ, રીપેરીંગના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહી તેનું ચેકીંગ કરવું. પ્રોજેક્ટના કામના ઓંમેન્ટેશનના કેપીટલ કામોના, રેવન્યુ કામોના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર સ્પેસીઝિકેશન મુજબ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું, પાવર પ્રોક્યોરમેન્ટની સમયબદ્ધ કામગીરી કરવી. કેપીટલ તેમજ રેવન્યુ કામોની એમ.બી. રેકોર્ડિંગ, મેઝરમેન્ટ તથા કવોલીટી ચકાસણીની કામગીરી., પાવર ઇક્ટર ઈમ્પ્રુવમેન્ટની કામગીરી.

		એનજર્ઝબીલનું દર માસે સ્કુટીની કરવું તથા એનજર્ઝ વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકિદે પગલાં લેવાં. જોનલ એક્ટીવીટી, હોલ, લીફ્ટ્સ, એ.સી., ફંક્શનસ, એ.એમ.સી.મેટ ઈવેન્ટ્સ સ્પેશીયલ તથા વરસાદની ઋતુમાં અનડરપાસમાં પાણી ભરાય તો તે માટે નિકાલની કામગીરી કોન્ટ્રાક્ટર મારફતે કરાવવી.
૪	આસી.ઇજનેર	કોઈપણ ઈલે.-મીકે. ઈક્વીપમેન્ટ બંધ ના રહે તેનું ધ્યાન રાખવું. ઈલે.મીકે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થિત રીપેરીંગ કરાવવું. પ્રીવેન્ટીલ મેઈન્ટેનાન્સ સમયસર થાય તેનું ખાલિન્ગ કરવું. કોન્ટ્રાક્ટ ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મ્સ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહી તેનું ચેકીંગ કરવું. ટેન્ડરમાં કેપીટલ/રેવન્યુ કામના એમ.બી. રેકોર્ડિંગ કરવું તેમજ મેઝરમેન્ટ ચેક કરવું. પ્રોજેક્ટ/ઓળ્મેન્ટેશનના કામમાં ઈરેક્ષન સમયે ટેકનીકલ ચકાસણી કરવી. સ્ટાફ સંબંધી વહીવટી કામગીરી કરવી. એનજર્ઝ ને લગતી કામગીરી. એનજર્ઝ બીલનું દર માસે સ્કુટીની કરવું તથા એનજર્ઝ વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકિદે પગલાં લેવાં. જોનલ એક્ટીવીટી, હોલ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એ.એમ.સી.મેટ ઈવેન્ટ્સ સ્પેશીયલની કામગીરી.
૫	ટેક.સુપરવાઇઝર	લેખીત રીપોર્ટ એ.ઇ./એ.સી.ઇ.ને દરરોજ આપવા, ડાયરી મેઈન્ટેઇન કરવી, કોઈપણ પ્રોલેમ હોય તો એ.ઇ./એ.સી.ઇ. અથવા તે.સી.ઇ.ને જાણ કરવી. દરેક જગ્યાની રેગ્યુલર સ્થળતપાસ કરવી તથા તેનો રીપોર્ટ ઉપરી અધિકારીને સબમીટ કરવો.
૬	લીફ્ટમેન	સમયસર લીફ્ટ ચલાવવાની કામગીરી.
૭	ઈલેક્ટ્રીશીયન	ઓવરઓલ તમામ ઓફિસ બિલ્ડિંગમાં મેઈન્ટેનાન્સ કામગીરી ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશનની લાઈટીંગ તથા જરૂરી વાયરીંગ કરવાની કામગીરી. વાયરમેન તથા વાયરમેન હેલ્પર વગેરેને માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૮	ટેલી. ઓપરેટર	બહારથી આવતા તથા આંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુષાંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા.
૯	રીસે.કમ ટેલી.ઓપરેટર	બહારથી આવતા તથા આંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુષાંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા.
૧૦	આસી. મેનેજર	જુદા જુદા ખાતાઓ લાઈટ, સ્ટ્રીટલાઈટ તથા વોટર ઓપરેશનને લગતાં વહીવટી કાર્ય આનુષાંગીક તમામ વહીવટી કામગીરી.
૧૧	ઓફિસ સુપ્રીટેન્નટ	આસી.મેનેજરશ્રીની સુચના અનુસાર તમામ કામગીરી.
૧૨	એકાઉન્ટન્ટ	ખાતાની નાણાંકીય તમામ કામગીરીનું સંચાલન.
૧૩	હેડ કલાર્ક	ઓફિસ સુપ્રી.ની સુચના અનુસાર વહીવટી કામગીરી.

૧૪	સીની. કલાર્ક	જુદા જુદા ખાતાઓ લાઈટ,સ્ટ્રીટલાઈટ તથા વોટર ઓપરેશનને લગતાં વિષયોની કામગીરી, ઈભ્રેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઈએમડી, પેમેન્ટ પહોંચ,લાઈટ તથા ટેલીફોનના બીલોને લગતી તમામ કામગીરી.
૧૫	જુની.કલાર્ક	બજેટ બુક, ઠરાવ, બીલ કલાર્ક, રીએમ્બર્સમેન્ટ, સર્વિસ બુક મેઇન્ટેનાન્સ, કર્મચારી/અધિકારી નિવૃત્તિ તથા સ્વૈ.નિવૃત્તિની કામગીરી, પોસ્ટેજ, આઈટવર્ક-ઇનવર્ક ની કામગીરી.
૧૬	પટાવાળા	ઇનડોર પટાવાળા - ખાતાકીય પટાવાળા તરીકેની કામગીરી આઉટડોર પટાવાળા - બહારના ખાતાને લગતી ટપાલો આપવા જવાની કામગીરી, તથા ખાતાકીય પત્રો પોસ્ટેજની કામગીરી
૧૭	જુની. ચાર્જમેન	મશીનરીની મિકેનીકલ ઈક્વીપમેન્ટની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીગની કામગીરી કરાવવી તથા મિકેનીકલ ગેંગ સાથે તેમજ ફીટર, ટર્નર, ગેંગમજુર વિગેરેને મિકેનીકલ માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૧૮	પંપ અને વાયરમેન એટેડન્ટ	પંપને લગતી કામગીરી.
૧૯	વાયરમેન	ઇલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટ તેમજ સંસ્થાના અન્ય વિભાગો વિગેરે રૂમોની લાઈટીંગ તથા જરૂરી વાયરીંગ કરવાની કામગીરી તથા ઇલેક્ટ્રીશીયનની સાથે ઇલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીગની કામગીરી કરવી.
૨૦	ફીટર	સેન્ટ્રીફ્યુગલ પંપ મોટર સેટ તથા મિકેનીકલ મશીનરીનાં પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કરવાની કામગીરી તેમજ આસી.ફીટરને મિકેનીકલ માર્ગદર્શન કરી કામગીરી કરાવવી.
૨૧	પંપમેન	પંપીંગ સ્ટેશનમાં આવેલ પંપો ચાલુ બંધ કરવાની કામગીરી
૨૨	વાયરમેન હેલ્પર	ઇલેક્ટ્રીશીયન અને/અથવા વાયરમેન સાથે સંસ્થાના અન્ય વિભાગની તમામ ઇલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટનાં ઓપરેશનની કામગીરી તેઓની સાથે રહી કરવી.
૨૩	ફીટર હેલ્પર	મીકે. કામમાં ફીટરને જરૂરી હેલ્પ કરવાની કામગીરી
૨૪	ગેંગ મજુર	તમામ ખાતાની ઇલેક્ટ્રીકલ, મિકેનીકલ મશીનરી તથા કલોરીન મશીનરીની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કામગીરી કરવાની ગેંગની સાથે રહી સુચના મુજબની મજુરીની કામગીરી.

(૩) દેખરેખ અને જવાબદારનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસારની માહિતી :

ખાતાની કામગીરીનાં અનુસંધાને જે તે સક્ષમ સત્તાની મંજુરી મેળવીને નિર્ણય લેવામાં આવે છે.

(૪) પોતાનાં કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણો :

જે તે કામગીરી માટે સક્ષમ સત્તાની જરૂરી મંજુરી મુજબ તુમાર અને ફાઈલોનો નિકાલ કરવામાં આવે છે.

- (૫) પોતાનાં કાર્યો બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાનાં નિયંત્રણ હેઠળનાં અથવા પોતાનાં કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ : અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશનનાં નીતિ-નિયમો તથા બોમ્બે પ્રોવિન્સીયલ ભૂનિસિપલ એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.
- (૬) પોતાની પાસે અથવા પોતાનાં નિયંત્રણ હેઠળ હોય તેવાં દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક : લાઈટ ખાતાનાં વર્ગ-૩ અને વર્ગ-૪ માં જુદા જુદા હોદ્દા હેઠળનાં કેટેગરી વાઈજ કર્મચારીઓ/અધિકારીઓની સર્વિસબુક, પગારનાં પત્રકો તથા તેને લગતાં આનુષાંગિક રેકર્ડ નિભાવવામાં આવે છે.
- (૭) તેની નીતિ અથવા તેનાં અમલીકરણનાં ઘડતર સંબંધમાં જનતાનાં સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન ગોઠવણીની વિગતો : આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૮) તેનાં ભાગ તરીકે અથવા તેની સલાહમાં હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓનાં બનેલાં બોર્ડ કાઉન્સીલો, સમિતિઓ અને બીજાં મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ : આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૯) તેનાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા : અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન મારફતે દર વર્ષે બહાર પાડવામાં આવતી ડાયરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત સદર ડાયરીની સોફ્ટકોપી અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.org પર મુકવામાં આવે છે. જેમાં દર વર્ષે અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવતી ડાયરીમાં અગત્યનાં ટેલીફોન નંબરોનો સમાવેશ કરવામાં આવે છે.
- (૧૦) તેનાં વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેનાં દરેક અધિકારીઓ અને મળતાં માસિક વળતર :

ક્રમ	હોદ્દો	પે મેટ્રીક્સ
૧	એડી. સી.ઈ.	૧૧૮૫૦૦-૨૧૪૧૦૦
૨	ડે.સી.ઈ.	૬૭૭૦૦-૨૦૮૭૦૦
૩	આ.સી.ઈ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૪	આસી.ઇજનેર	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૫	ટેક.સુપરવાઈઝર	૨૮૨૦૦-૬૨૩૦૦
૬	લીફ્ટમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૭	ઇલેક્ટ્રીશયન	૨૫૫૦૦-૮૧૧૦૦
૮	ટેલી. ઓપરેટર	૨૫૫૦૦-૮૧૧૦૦
૯	રીસે.ક્રમ ટેલી.ઓપરેટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૦	આસી. મેનેજર	૫૩૧૦૦-૧૬૭૮૦૦
૧૧	ઓફિસ સુપ્રીટેન્નટ	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૧૨	એકાઉન્ટન્ટ	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૩	હેડ કલાર્ક	૩૪૪૦૦-૧૧૨૪૦૦
૧૪	સીની. કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૫	જુની. કલાર્ક	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૬	પટાવળા	૧૪૮૦૦-૪૭૧૦૦
૧૭	જુની. ચાર્જમેન	૨૫૫૦૦-૮૧૧૦૦
૧૮	પંપ અને વાયરમેન એટેન્ટ	૧૮૬૦૦-૬૩૨૦૦
૧૯	વાયરમેન	૧૮૬૦૦-૬૩૨૦૦
૨૦	ફીટર	૧૮૬૦૦-૬૩૨૦૦
૨૧	પંપમેન	૧૪૭૦૦-૫૦૦૦૦
૨૨	વાયરમેન હેલ્પર	૧૪૭૦૦-૫૦૦૦૦
૨૩	ફીટર હેલ્પર	૧૪૭૦૦-૫૦૦૦૦
૨૪	ગોગ મજૂર	૧૪૮૦૦-૪૭૧૦૦

(૧૧)તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરનાં અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર :

સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અને વર્ષ ૨૦૨૧-૨૨ નાં અંદાજપત્રમાં મુકવામાં આવેલ છે.

(૧૨)ફાળવેલ રકમ અને એવા કાર્યક્રમોનાં લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩)આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો :

સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અતેના ખાતાને લગતી માહિતી, અગત્યનાં ટેલીફોન નંબરો તથા વર્ષ ૨૦૨૧-૨૨ નાં અંદાજપત્ર તથા બીજી અગત્યની માહિતી ઉપલબ્ધ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવમાં આવતાં હોય તેવા ગ્રંથપાલ અથવા તેનાં વાંચનાલયનાં કામકાજનાં કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદાઓ અને બીજી વિગતો :

ક્રમ	અધિકારીનું નામ અને હોદ્દો	ફરજનો સમય	ફરજનું સ્થળ	સંપર્ક નંબર
૧	શ્રી વિશાલ કે.નાયક એડી. ચીફ એન્જનીયર અને અપીલ અધિકારીશ્રી(લાઈટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાખીઠ, અમદાવાદ	M -૮૭૧૨૮૬૭૭૨૪ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૨	શ્રી એ. એ. મલ દે. સીટી એન્જનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૨)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાખીઠ, અમદાવાદ	M -૮૩૭૬૦૧૭૫૬૫ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૩	શ્રી હિંગીજયસિંહ ગઢવી દે. સીટી એન્જનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૪)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“સી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાખીઠ, અમદાવાદ	M -૮૩૨૭૦૩૮૭૭૯ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૪	શ્રી નરસિંહભાઈ એન.ગામેતી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટી બાબત)	સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી	“બી”-બ્લોક, ચોથો માળ, સરદાર પટેલ ભવન, દાણાખીઠ, અમદાવાદ	O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧

(૧૭) દરાવવામાં આવે તેવી બીજી માહિતી :

નથી.

અનેક્ષાર-અ

(સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૧-૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક-પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આર્ટીઆઈસેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણ પત્ર આપવામાં આવે છે કે લાઇટ વિભાગના જાહેર સત્તામંડળ દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ (૧) (ખ) અંતર્ગત સ્વચંમ જાહેર કરવાની બાબતો - પ્રોએક્ટીવ ડીસ્કલોગર (પીએડી) તૈયાર કરવામાં આવેલ છે.

જે તા.૦૧.૦૫.૨૦૨૧ ની સ્થિતીએ અધ્યયતન કરવામાં આવેલ છે. જેનું અમારા દ્વારા ઈન્સપેક્શન કમ ઓડિટ કરવામાં આવેલ છે અને જે બાબતે અપુરતી વિગતો જણાએ હતી તેની પુર્તતા કરાવવામાં આવેલ છે.

**એડી. ચીફ એન્જીનીયર
(લાઇટ)**

મુખ્ય મથક - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
સરદાર પટેલ ભવન, સી-લોક, પાંચમો માળ,
દાણાપીઠ, ખમાસા રોડ, અમદાવાદ

કચેરીનું નામ -લાઇટ ખાતું

ખાતાનું નામ : લાઈટ
તા.૦૭/૦૮/૨૦૨૧

પ્રતિ,
જાહેર માહિતી અધિકારી અને એસેસર અને ટેક્સ કલેક્ટરશ્રી,
આર.ટી.આઈ. સેલ વિભાગ
સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર
(વર્ષ ૨૦૨૧-૨૨) ની માહિતી બાબત...

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ ખાતાની વર્ષ ૨૦૨૧-૨૨ માટે જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે સામેલ છે, તો સદરહું માહિતીને જાહેર માહિતી અધિનિયમ હેઠળ આગળની આનુષાંગિક કાર્યવાહી થઈ આવવા રખાવી લેવા વિનંતી સહ.

ઓ. એસ.
(લાઈટ)

ડ.એચ.ઓ.ડી.
(લાઈટ)

એડી. ચીફ એન્જનીયર
(લાઈટ)

પ્રતિ,
ડ. મ્યુનિસિપલ કમિશનરશી,
(લાઈટ ડિપાર્ટ.)

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર
(વર્ષ ૨૦૨૧-૨૨) ની માહિતી બાબત....

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ ખાતાની વર્ષ ૨૦૨૧-૨૨ માટે જાહેર
માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે
સામેલ છે, તો સદરહું માહિતી પ્રોએક્ટિવ ડિસ્કલોઝર તરીકે સંસ્થાની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવાની હોઈ
આપ સાહેબશ્રીની મંજુરી થઈ આવવા વિનંતી છે.

ઓ. એસ.
(લાઈટ)

ડ. એચ. ઓ. ડી.
(લાઈટ)

એડી. ચીફ એન્જનીયર
(લાઈટ)

ડ. મ્યુનિ. કમિશનર
(લાઈટ)